

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવલ
ડિપ્લોમા અભ્યાસક્રમ - (W.E.F 2020-21)

કક્ષા	ડિપ્લોમા યોગ	ગુણ	૭૦
પ્રશ્નપત્ર નં.૧	યોગ વિજ્ઞાન	સમયગાળો	૧ વર્ષ
વિષય કોડ	૬૧ (DIY)	પેપર કોડ	૬૧૧
યુનિટ	૦૩	ક્રેડિટ	૦૩

યુનિટ-૧	ગુણ	કલાક	ક્રેડિટ
- યોગ પરિચય, વ્યાખ્યા, મહત્વ - મહર્ષિ પતંજલિ નિર્દેશિત અષ્ટાંગ યોગનો પરિચય - યમ, નિયમનો પરિચય, પ્રકાર અને મહત્વ	૨૫	૧૬	૧
હેતુ :- યોગના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન મળે છે.			
યુનિટ-૨	ગુણ	કલાક	ક્રેડિટ
- આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ- અર્થ, પ્રકાર અને મહત્વ	૨૦	૧૩	૧
હેતુ :- અષ્ટાંગ યોગનું સંપૂર્ણ જ્ઞાન મળે છે.			
યુનિટ-૩	ગુણ	કલાક	ક્રેડિટ
- શરીરમાં આવેલ ચક્રો તથા ત્રણ નાડીઓનો પરિચય - સ્વાસ્થ્યની વ્યાખ્યા, સ્વાસ્થ્ય રક્ષા માટે યોગનો ઉપયોગ - યોગનો સ્વાસ્થ્ય સંવર્ધક પ્રભાવ - માનસિક સ્વાસ્થ્ય - માનસિક રોગ ઉત્પન્ન થવાના કારણો - યોગ દ્વારા માનસિક રોગની સારવાર - ભાવનાત્મક સ્વાસ્થ્યનો પરિચય - હકારાત્મક -નકારાત્મક ભાવના	૨૫	૧૬	૧
હેતુ :- યોગની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થતી અસરો જાણી શકાય છે.			
મુખ્ય હેતુ :- યોગના જ્ઞાનની પ્રાપ્તિ, સંપૂર્ણ સમજ, વ્યવહારીક જીવનમા યોગના ઉપયોગની સમજણ મળે છે.			

સંદર્ભ ગ્રન્થ સૂચી :-

- (૧) ભાણદેવજી - અષ્ટાંગ યોગ
- (૨) અરુણ ઠાકર - યોગ સૈદ્ધાંતિક ભાગ-૧ અને ભાગ-૨, ગુર્જર પ્રકાશન
- (૩) સ્વામિ શિવાનંદ - અષ્ટાંગ યોગ, શિવાનંદ આશ્રમ
- (૪) યોગ દર્શન - ચૌખમ્બા પ્રકાશન
- (૫) યોગ દર્શિકા - ભાગ - ૧ થી ૬, રાજર્ષી મુનિ - કાયાવરોહણ
- (૬) સ્વામી કૃપાલ્લાનંદજી - આસન અને મુદ્રા
- (૭) બી. કે. આયંગર - યોગ દિપીકા
- (૮) ડો. આઈ જે. રત્નાણી - માનસિક સ્વાસ્થ્ય બુક સેલ્ફ પબ્લીકેશન
- (૯) ડો. પ્રતિક્ષાબેન રાવલ - માનસિક સ્વાસ્થ્ય


REGISTRAR,

Shree Somnath Sanskrit University
Veraval, Dist. Junagadh (Gujarat)

27 OCT 2020

1

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવલ
ડિપ્લોમા અભ્યાસક્રમ - (W.E.F 2020-21)

કક્ષા	ડિપ્લોમા યોગ	ગુણ	૭૦
પ્રશ્નપત્ર નં.૨	શરીર રચના અને આરોગ્ય વિજ્ઞાન	સમયગાળો	૧ વર્ષ
વિષય કોડ	૬૧ (DIY)	પેપર કોડ	૬૧૨
યુનિટ	૦૩	ક્રેડિટ	૦૩

યુનિટ-૧	ગુણ	કલાક	ક્રેડિટ
<ul style="list-style-type: none"> - શરીરના વિભિન્ન તંત્રોનો સામાન્ય પરીચય અને યોગ અભ્યાસનો તંત્રો પર અસર - રૂધિરાભિપરણ તંત્ર - પાચનતંત્ર - શ્વસનતંત્ર - અસ્થિતંત્ર - સ્નાયુતંત્ર - અંતઃસ્ત્રાવી ગ્રંથીઓનો સામાન્ય પરીચય 	૨૫	૧૬	૧
હેતુ :- માનવ શરીર રચના અને કાર્યો વિશે સમજ મળે છે.			
યુનિટ-૨	ગુણ	કલાક	ક્રેડિટ
<ul style="list-style-type: none"> - આહારની વ્યાખ્યા, મહત્વ, ઉદ્દેશ્ય - આહારના ઘટકો - સમતોલ આહાર - સ્વાસ્થ્ય પર આહારનો પ્રભાવ - પડરસ પરીચય તથા નિમ્નલિખિત ઔષધ દ્રવ્યનો પરિચય, ગુણ, ઉપયોગ. આદુ, મરી, હળદર, મેથી, લસણ, હીંગ, તૂલસી, અરડુસી, અશ્વગંધા 	૨૦	૧૩	૧
હેતુ :- આહારના જ્ઞાન અને ઉપયોગીતા દ્વારા સ્વાસ્થ્ય વૃદ્ધિ થાય છે.			
યુનિટ-૩	ગુણ	કલાક	ક્રેડિટ
<ul style="list-style-type: none"> - યૌગિક ચિકિત્સાના અંગો - નીચેના રોગના લક્ષણો, કારણો અને યૌગિક ઉપચાર માથાનો દુઃખાવો, રકતચાપ, દમ, ગેસ, કબજીયાત, મંદાગ્નિ, મધુપ્રમેહ - આયુર્વેદનો સામાન્ય પરિચય - નિસર્ગોપચારનો સામાન્ય પરિચય અને અંગો. 	૨૫	૧૬	૧
હેતુ :- યૌગિક ચિકિત્સા, નિસર્ગોપચાર અને આયુર્વેદનો પરિચય અને તેની સમજણ કેળવી શકાય છે.			
મુખ્ય હેતુ :- માનવ શરીર રચના, ક્રિયા અને આરોગ્ય સંબંધીત જ્ઞાનનું સંવર્ધન થાય છે.			

સંદર્ભ ગ્રંથ સૂચી :-

- (૧) ગાંધી હરીકિશન બી. - આસન ચિકિત્સા - આરોગ્ય વિભાગ ભાગ-૧ અને ભાગ-૨
- (૨) રાઠોડ નલીની અને અંશુમાન - યોગ અને યોગોપચાર
- (૩) દેરાશરી હરી રણજીત - માનવ શરીર રચના, શરીર ક્રિયા અને સ્વાસ્થ્ય વિજ્ઞાન - યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ- અમદાવાદ
- (૪) પટેલ હરીભાઈ કે. - સ્વસ્થવૃત્ત
- (૫) વૈધ બાપાલાલ - માનવ આરોગ્ય - યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ- અમદાવાદ
- (૬) ડો. અનંતપ્રકાશ ગુપ્તા - માનવ શરીર રચના અને ક્રિયા વિજ્ઞાન - સુમિત પ્રકાશન - આગ્રા
- (૭) ડો. એન. પી. શર્મા - શરીર રચના એવમ ક્રિયા વિજ્ઞાન, ખેલ સાહિત્ય કેન્દ્ર, નઈ દિલ્હી
- (૮) ડો. એસ ગૌડ - આયુર્વેદિય શરીર ક્રિયા વિજ્ઞાન, નાથ પુસ્તક ભંડાર - રોહતક
- (૯) શરીર ક્રિયા વિજ્ઞાન - દેવ સંસ્કૃત વિશ્વવિદ્યાલય - હરિદ્વાર
- (૧૦) આહાર ઔર સ્વાસ્થ્ય- ડો. હિરાલાલ

27 OCT 2020


REGISTRAR,

Shree Somnath Sanskrit University,

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવલ
ડિપ્લોમા અભ્યાસક્રમ - (W.E.F 2020-21)

કક્ષા	ડિપ્લોમા યોગ	ગુણ	૭૦
પ્રશ્નપત્ર નં.૩	પ્રાયોગિક યોગ	સમયગાળો	૧ વર્ષ
વિષય કોડ	૬૧ (DIY)	પેપર કોડ	૬૧૩
યુનિટ	૦૩	ક્રેડિટ	૦૩

યુનિટ-૧	ગુણ	ક્લાક	ક્રેડિટ																														
<ul style="list-style-type: none"> - પ્રાર્થના, મંત્રો, ભાવગીતો (સંસ્કૃતમાં) - યોગિક શારીરિક ક્રિયાઓ - સૂર્યનમસ્કાર - આસન <table style="width: 100%; border: none;"> <tr> <td>૧. પદ્માસન</td> <td>૨. યોગાસન</td> <td>૩. જનુશિરાશન</td> </tr> <tr> <td>૪. ગૌમુખાસન</td> <td>૫. ભદ્રાસન</td> <td>૬. વજાસન</td> </tr> <tr> <td>૭. શશાંકાસન</td> <td>૮. અર્ધમત્સ્યેન્દ્રાસન</td> <td>૯. આકર્ણધનુરાસન</td> </tr> <tr> <td>૧૦. પવનમુક્તાસન</td> <td>૧૧. પશ્ચિમોતાસન</td> <td>૧૨. લોલાસન</td> </tr> <tr> <td>૧૩. ઉષ્ટ્રાસન</td> <td>૧૪. ઉગ્રાસન</td> <td>૧૫. તાડાસન</td> </tr> <tr> <td>૧૬. શાહમૃગાસન</td> <td>૧૭. તીર્થકાસન</td> <td>૧૮. પાદહસ્તાસન</td> </tr> <tr> <td>૧૯. અર્ધચંદ્રાસન</td> <td>૨૦. સુપ્તવજાસન</td> <td>૨૧. મત્સ્યાસન</td> </tr> <tr> <td>૨૨. ભુજંગાસન</td> <td>૨૩. હલાસન</td> <td>૨૪. સર્પાસન</td> </tr> <tr> <td>૨૫. ઉતાનપાદાસન</td> <td>૨૬. અર્ધધનુરાસન</td> <td>૨૭. સર્વાંગાસન</td> </tr> <tr> <td>૨૮. વક્ષપાદાસન</td> <td>૨૯. ચક્રાસન</td> <td>૩૦. પર્વતાસન</td> </tr> </table> - શિથિલીકરણ. 	૧. પદ્માસન	૨. યોગાસન	૩. જનુશિરાશન	૪. ગૌમુખાસન	૫. ભદ્રાસન	૬. વજાસન	૭. શશાંકાસન	૮. અર્ધમત્સ્યેન્દ્રાસન	૯. આકર્ણધનુરાસન	૧૦. પવનમુક્તાસન	૧૧. પશ્ચિમોતાસન	૧૨. લોલાસન	૧૩. ઉષ્ટ્રાસન	૧૪. ઉગ્રાસન	૧૫. તાડાસન	૧૬. શાહમૃગાસન	૧૭. તીર્થકાસન	૧૮. પાદહસ્તાસન	૧૯. અર્ધચંદ્રાસન	૨૦. સુપ્તવજાસન	૨૧. મત્સ્યાસન	૨૨. ભુજંગાસન	૨૩. હલાસન	૨૪. સર્પાસન	૨૫. ઉતાનપાદાસન	૨૬. અર્ધધનુરાસન	૨૭. સર્વાંગાસન	૨૮. વક્ષપાદાસન	૨૯. ચક્રાસન	૩૦. પર્વતાસન	૨૫	૧૬	૧
૧. પદ્માસન	૨. યોગાસન	૩. જનુશિરાશન																															
૪. ગૌમુખાસન	૫. ભદ્રાસન	૬. વજાસન																															
૭. શશાંકાસન	૮. અર્ધમત્સ્યેન્દ્રાસન	૯. આકર્ણધનુરાસન																															
૧૦. પવનમુક્તાસન	૧૧. પશ્ચિમોતાસન	૧૨. લોલાસન																															
૧૩. ઉષ્ટ્રાસન	૧૪. ઉગ્રાસન	૧૫. તાડાસન																															
૧૬. શાહમૃગાસન	૧૭. તીર્થકાસન	૧૮. પાદહસ્તાસન																															
૧૯. અર્ધચંદ્રાસન	૨૦. સુપ્તવજાસન	૨૧. મત્સ્યાસન																															
૨૨. ભુજંગાસન	૨૩. હલાસન	૨૪. સર્પાસન																															
૨૫. ઉતાનપાદાસન	૨૬. અર્ધધનુરાસન	૨૭. સર્વાંગાસન																															
૨૮. વક્ષપાદાસન	૨૯. ચક્રાસન	૩૦. પર્વતાસન																															

હેતુ :- શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને પ્રબળ બનાવી શકાય છે.

યુનિટ-૨	ગુણ	ક્લાક	ક્રેડિટ												
<ul style="list-style-type: none"> - પ્રાણાયામ (ઓમકાર, સૂર્યભેદન, ચંદ્રભેદન, નાડી શુદ્ધિ, શિતલી, શીતકારી, ભસ્ત્રીકા, ભ્રામરી) - ત્રિબંધ - ધ્યાન - મુદ્રાઓ <table style="width: 100%; border: none;"> <tr> <td>૧. જ્ઞાનમુદ્રા</td> <td>૫. પૃથ્વીમુદ્રા</td> <td>૦૯. પ્રાણમુદ્રા</td> </tr> <tr> <td>૨. ધ્યાનમુદ્રા</td> <td>૬. શુન્ય મુદ્રા</td> <td>૧૦. અપાન મુદ્રા</td> </tr> <tr> <td>૩. વાયુમુદ્રા</td> <td>૭. સૂર્યમુદ્રા</td> <td>૧૧. વ્યાનમુદ્રા</td> </tr> <tr> <td>૪. આકાશ મુદ્રા</td> <td>૮. વૃક્ષમુદ્રા</td> <td>૧૨. ઉદાનમુદ્રા</td> </tr> </table> 	૧. જ્ઞાનમુદ્રા	૫. પૃથ્વીમુદ્રા	૦૯. પ્રાણમુદ્રા	૨. ધ્યાનમુદ્રા	૬. શુન્ય મુદ્રા	૧૦. અપાન મુદ્રા	૩. વાયુમુદ્રા	૭. સૂર્યમુદ્રા	૧૧. વ્યાનમુદ્રા	૪. આકાશ મુદ્રા	૮. વૃક્ષમુદ્રા	૧૨. ઉદાનમુદ્રા	૨૦	૧૩	૧
૧. જ્ઞાનમુદ્રા	૫. પૃથ્વીમુદ્રા	૦૯. પ્રાણમુદ્રા													
૨. ધ્યાનમુદ્રા	૬. શુન્ય મુદ્રા	૧૦. અપાન મુદ્રા													
૩. વાયુમુદ્રા	૭. સૂર્યમુદ્રા	૧૧. વ્યાનમુદ્રા													
૪. આકાશ મુદ્રા	૮. વૃક્ષમુદ્રા	૧૨. ઉદાનમુદ્રા													

હેતુ :- એકાગ્રતા અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.

યુનિટ-૩	ગુણ	ક્લાક	ક્રેડિટ
શુદ્ધિ ક્રિયાઓ <ul style="list-style-type: none"> - કપાલભાતિ, - ત્રાટક - જલનેતી (શીતક્રમ), - જલપોટ, - સૂત્રનેતી, - કેથેટર. 	૨૫	૧૬	૧

હેતુ :- આંતરીક અંગોની શુદ્ધિ અને ત્રિદોષનું સમન થાય છે.

મુખ્ય હેતુ :- રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સર્વાંગી વિકાસ થાય છે.

27 OCT 2020

2


REGISTRAR,
Shree Somnath Sanskrit University

संदर्भ ग्रन्थ सूची :-

- (१) आसन-प्राणायाम, मुद्रा, बंध, - बिहार योग विद्यालय, मुंगेर (बिहार)
- (२) योग प्रदिपीका - भाग १ थी ६ , लार्ड्स मिशन - वडोदरा
- (३) घेरंड संहिता - योग पब्लिकेशन ट्रस्ट, मुंगेर (बिहार)
- (४) छठयोग प्रदिपीका - प्रकाशक - कैवल्यधाम - लोनावाला
- (५) बी. के. एस. आयंगर - योग दिपीका
- (६) स्वामी कृपाल्वानंदजी - आसन अने मुद्रा

127 OCT 2020



REGISTRAR,

Shree Somnath Sanskrit University
Veraval, Dist. Junagadh (Gujarat)